

**પાઠ 19**

### હોળીના દિવસે ફેસી ડ્રેસ કાર્યક્રમ

**અરુણ :** કાન્તા, કાલે હોળીનો તહેવાર ઉજવ્યો?

**કાન્તા :** હા, ઉજવ્યો. આ તો વર્ષનો વિશેષ તહેવાર છે. આની તો સૌને પ્રતીક્ષા રહે છે.

**અરુણ :** હા, હોળી ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર છે. જેમ-જેમ ફણગણ મહીનો નજીક આવે છે તેમ-તેમ આ તહેવાર પ્રત્યે ઉમંગ વધતો જાય છે.

**કાન્તા :** કાલે તો અમારા ફળિયામાં હોળીનો પ્રારંભ ખૂબ જ આનંદની સાથે થયો. સવાર-સવારમાં નાનાં-નાનાં બોળકોની ટોળકીઓ ઘરે-ઘરે ફરીને ફળો એકઠો કરવામાં લાગી ગઈ. અમારા ફળિયામાં જે હોળી પ્રગટે છે. તેને મોટી હોળી કહે છે.

**અરુણ :** આખા શહેરમાં ફળિયે-ફળિયે બધાં લોકો હોળી પ્રગટાવે છે. ઠેર-ઠેર ઉત્સવ ઉજવાય છે.

**કાન્તા :** અમારા ફળિયાના છોકરાઓએ હોળીની આસપાસ ડોલો ભરી-ભરીને પાણી લાંટયું અને હળીમળીને સફાઈ કરી.

**કમલેશ :** હોળી પ્રગટાવવાનો સમય રત્ને આठ વાગ્યાનો હતો. નાના-નાના છોકરા-છોકરીઓ,

### હોળી કે દિન ફેસી ડ્રેસ કાર્યક્રમ

**અરુણ :** કાંતા, કલ હોળી કા ત્યોહાર મનાયા?

**કાંતા :** હાઁ મનાયા। યહ તો વર્ષ કા વિશેષ ત્યોહાર હૈ। ઇસકી તો સબકો પ્રતીક્ષા રહતી હૈ।

**અરુણ :** હાઁ। હોળી ઉમંગ ઔર ઉલ્લાસ કા ત્યોહાર હૈ। જેસે-જેસે ફાગુન મહીના પાસ આતા હૈ વૈસે-વૈસે ઇસ ત્યોહાર કે પ્રતિ ઉમંગ બઢતા જાતા હૈ।

**કાંતા :** કલ તો હમારે મોહલ્લે મેં હોળી કા પ્રારંભ બહુત હી આનંદ કે સાથ હુआ। સવેરે-સવેરે મેં છોટે-છોટે બચ્ચોં કી ટોલિયાં ઘર-ઘર ઘૂમ-ઘૂમ કર ચંદા ઇકડ્બા કરને મેં જુટગઈ। હમારે મોહલ્લે મેં જો હોળી જલતી હૈ ઉસે બઢી હોળી કહતે હું।

**અરુણ :** પૂરે શહર મેં મોહલ્લે-મોહલ્લે સબ લોગ હોળી જલાતે હૈ। જગહ-જગહ ઉત્સવ મનાતે હું।

**કાંતા :** હમારે મોહલ્લે કે લડ્કોને હોળી કે આસ-પાસ બાલ્ટિયાં ભર-ભર કર પાની છિંકા ઔર મિલ-જુલકર સફાઈ કી।

**કમલેશ :** હોળી પ્રજ્વલિત કરને કા સમય રાત કે આठ બજે કા થા। છોટે-છોટે લડ્કે-લડ્કિયાં યુવક-યુવતીયાં, આબાલ-વૃદ્ધ

યુવક-યુવતીઓ, અભાલવૃદ્ધ સૌ હોળીની ચારે બાજુ એકઠા થઈ ગયા. છોકરા-છોકરીઓએ અણાંનાં હોળાયાં હોળી પર ચઢાવ્યાં.

**સુનંદા :** કાલે બરાબર આઠ વાગે હોળી પ્રગટાવી. સ્ત્રી પુરુષોએ પાણી લઈને હોળીની આજુબાજુ ફરતાં-ફરતાં પ્રદક્ષિણા કરી. ધાણી, થણા, શ્રીફળ વગેરે હોળીમાં પદ્ધરાવાયાં.

**કાન્તા :** હોળી દછન પણી બધા લોકો પોત-પોતાના ઘરે પાછાં ગયાં.

**કુસુમ :** રાત્રે નાનાં-નાનાં બાળકો, વૃદ્ધો, જુવાન સૌ હોળી ફરતે ભેગાં થયાં. ફેસી ડ્રેસ કાર્ધકમમાં ભાગ લેનારા છોકરાઓ સારા-સારા પોશાક પહેરી તૈયાર હતાં.

**કમલેશ :** બધાંની સામે આવીને માલણ બનેલી મંજુલા ધીરે ધીરે બોલી, ઝૂલ લો ઝૂલ, રંગરંગનાં ઝૂલો, તમારે માટે વીણી-વીણીને લાવી છું. આમ બોલતી-બોલતી તે ચાલી ગઈ.

**કાન્તા :** ત્યાંજ હરિ-હરિ બોલતો-બોલતો સાધુનો વેશ ધરી શર્ટાંક આવ્યો. તેની તોતડી બોલીમાં હર હર મહાદેવ સાંભળીને બધા ગદગદ થઈ ગયા. આ વચ્ચે તેની નકલી દાઢી-મૂછ નીચે પડી ગઈ. બધા લોકો હસીહસીને લોથપોથ થઈ ગયા.

સભી હોળી કે ચારોં ઓર ઇકઢે હોગણ. લડુકે-લડુકિયોં ને ગોબર કે બડોલિયાં હોળી પર ચઢાએ।

**સુનંદા :** કલ ઠીક આઠ બજે હોળી પ્રજ્ઞલિત કી। સ્ત્રી પુરુષોને પાની લેકર હોળી કે ચારોં-ઓર ઘૂમતે-ઘૂમતે પ્રદક્ષિણા કી। ફૂલ, ચને, શ્રીફળ આદિ હોળી મેં પદ્ધરાએ।

**કાંતા :** હોળી દહન કે બાદ સભી લોગ અપને-અપને ઘર લોટ ગણ.

**કુસુમ :** રાત કો છોટે-છોટે બચ્ચે, બૂઢે યુવક સભી હોળી કે ચારોં ઓર ઇકઢે હુએ। ફેસી ડ્રેસ મેં ભાગ લેનેવાલે બચ્ચે અચ્છી-અચ્છી પોશાકે પહન કર તૈયાર થે।

**કમલેશ :** સબ કે સામને આકર માલિન બની હુઈ મંજલા ધીરે-ધીરે બોલી, "ફૂલ લો ફૂલ, રંગ-રંગ કે ફૂલ। આપ કે લિએ ચુન-ચુનકર લાઈ હું!" એસા બોલતી-બોલતી વહ ચલી ગઈ।

**કાંતા :** તભી હરિ-હરિ બોલતા બોલતા, સાધુ કા વેશ બનાએ શશાંક આયા। ઉસકે તુતલી-તુતલી બોલી મેં હર-હર મહાદેવ સુનકર સબ ગદ-ગદ હો ઉઠે। ઇસી બીચ ઉસકી નકલી ડાઢી-મૂછ નીચે ગિર પડી। સબ લોગ હંસ-હંસ કર લોટ-પોટ હોગણ।

**સુનંદા :** પોલિસ બનેલો તુષાર દોડતો દોડતો આવ્યો અને લાકડી પણાડતો પણાડતો બોલ્યો, 'સાંભળો-સાંભળો ભાઈઓ શું તમે કોઈ ચોરને જોયો? હું તેને શોધતો શોધતો અહીં સુધી આવ્યો છું. ચાલી ચાલીને થાકી ગયો છું. પણ શું કરું? ફરજ એટલે ફરજ.'

**કુસુમ :** તેના જતાં જ ચોર બનેલો નીરજ સંતાતો સંતાતો ત્યાં આવ્યો અને સ્વગત બોલ્યો, 'મને અહીં દહાડે કશું મળતું નથી. અને પેલો પોલિસવાળો રાત્રે મન શોધવા નીકળ્યો છે મૂર્ખો.' આ પોલિસથી બચતાં બચતાં હું જલ્દી-જલ્દી દોડતો દોડતો જેમ-તેમ અહીં પહોંચ્યો. પણ આ તો એવું જ થયું કે આગળ આગળ ચોર પાછળ પાછળ પોલિસ.

**કાન્તા :** ચોર બનેલો નીરજ ત્યાંથી ગયો જ હતો કે સીસોટી વગાડતો વગાડતો પીઠી ટીચર બનેલો કેતન આવ્યો. દંડો ઊંચો કરતાં કરતાં બોલ્યો, 'ચાલો બધાં એક કતારમાં ઉભા રહી જાઓ. છોકરીઓ છોકરીઓ ડાખી બાજુ અને છોકરાઓ છોકરાઓ જમણી બાજુ સાવધાન-વિશ્રામ.' પી.ટી. ટીચરની કમાન આપવાની સ્ટાઇલ બધાંને ખૂબ જ સારી લાગી.

**સુનંદા :** પુલિસ બના હુઆ તુષાર દૌડતા-દૌડતા આયા ઔર લકડી પટકતે-કટકતે બોલા, "સુનો-સુનો ભાઇયો ક્યા આપને કિસી ચોર કો દેખા? મૈં ઉસે ઢૂંઢતા-ઢૂંઢતા યહોં તક આયા હું। ચલ-ચલકર થક ગયા હું। પર ક્યા કરું, ફર્જ યાને ફર્જ!"

**કુસુમ :** ચોર બના-હુઆ નીરજ છિપતે-છિપતે વહીં આયા ઔર સ્વયં બોલા "મુઝે તો યહોં દિન મેં કુછ નહીં મિલતા ઔર પુલિસ વાલા રાત મેં મુઝે ઢૂંઢને નિકલા હૈ, સૂર્ય કહીં કા। ઇસ પુલિસ સે બચતે-બચતે મૈં જલ્દી-જલ્દી દૌડતા-દૌડતા જૈસે-તૈસે યહોં પહુંચા। લેકિન યહ તો વૈસા હુઆ કિ આગે-આગે ચોર પીછે-પીછે પુલિસ!"

**કાંતા :** ચોર બના હુઆ નીરજ વહોં સે ગયા થા કિ સીટી બજાતે-બજાતે પિટિ ટીચર બના હુઆ કેતન આયા। ડંડા ઊંચા કરતે-કરતે બોલા, "ચલો સબ એક કતાર મેં ખઢે હો જાઓ। લડકિયાં લડકિયાં બાઈ તરફ ઔર લડકે-લડકે દાયી તરફ।" સાવધાન-વિશ્રામ। પિટિટીચર કા કમાડ દેને કા અંદાજ સબ કો બહુત અચ્છા લગા।

**કમલેશ :** છેલ્લા આવ્યો એક નેતા. આ ઘોળો ધર્ભ ઝર્ભો લેંધો પહેરી, ચક્કાકતા બુટથી ખર-ખર અવાજ કરતા નેતાજી પોતાના હાથમાં લીધેલા માઈક પર વારંવાર બરાડી બરાડીને ભાષણ આપવા લાગ્યા. તેમનું ભાષણ ખૂબ મજાકિયું હતું. તેને જોઈ બધા ખૂબ હસ્યા.

કાન્તા : આમ હસતાં હસતાં  
આનંદથી ફેરી ડ્રેસ કાર્યક્રમ  
સંપજ્ઞ થયો. બધાંએ વારંવાર  
તાળીઓ પાડીપાડીને કલાકારોનો  
ઉત્સાહ વધાર્યો. આ પ્રમાણે  
હોળી દહન અને ફેરી ડ્રેસનો  
કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો.  
બધાં લોકો રાજ્યભુષણ  
પોતપોતાના ઘરે પાછા ગયા.

અરૂપા : વાહ, તારા ફળિયાનો  
 હોળીનો ઉત્સવ તો ખૂબ જ  
 સરસ રદ્ધી. (ત્યાં જ કાન્તા,  
 કુસુમ, સુનંદા અને કમલેશ  
 અરૂપાને ગુલાલ લગાવે છે.  
 અરૂપા પણ બધાંને ગુલાલ  
 લગાવે છે. બધા લોકો એક  
 સ્વરમાં જોરજોરથી બોલ્યા,  
 ખોડું ન લગાડશો હોળી છે.)

**कमलेश :** अंत में आए एक नेताजी। यह वेश  
अजित ने धारण किया था। सफेद झक्क  
कुर्ता पायजामा पहने, चम-चमाता बुरों से  
खट-खट आवाज करते नेताजी अपने  
हाथ में लिए हुए माइक पर बार-बार  
चिल्ला-चिल्ला कर भाषण देने लगे।  
उनका भाषण बहुत विनोदी था। उसे  
देखकर सब लोग खूब-खूब हँसे।

**कांता :** इस प्रकार हंसते-हंसते आनंद से फेंसी ड्रेस का कार्यक्रम संपन्न हुआ। सब ने बार-बार तालियाँ बजा-बजा कर कलाकारों का उत्साह बढ़ाया। इस प्रकार होली दहन और फेंसी ड्रेस का कार्यक्रम समाप्त होगया। सब लोग अपने-अपने घर लौट गए।

**अरुण :** वाह, तुम्हारे मोहल्ले का होली उत्सव तो बहुत ही बढ़िया रहा। (तभी, कांता, कुसुम, सुनंदा और कमलेश अरुण को गुलाल लगाते हैं। अरुण भी सबको गुलाल लगाता है। सब लोग एक स्वर से चिल्ला-चिल्ला कर बोले "बुरा न मानो होली है"।

୧୮୬୨

ગુજરાતી શબ્દ	હિન્ડી અર્થ
હોળી	હોલી
તહેવાર	ત્યોહાર
જાણવું	જાનના
ઉજવતું	મનાના
એકઠાં કર્યા	ઇકછે કિએ
દિવસ	દિન

હેસ્ટી ડ્રેસ	સ્વાંગ ધરના
પ્રગટાવવું	પ્રજ્વલિત કરના
જ્વયા	જગહ
છાણાંની માળા	ગૂઠરિયો (ગોબર સે આકૃતિ વાલી માળ)
બરાબર	ઠીક
આજુભાજુ	ચારોં ઓર
ધાણી	ફૂલે (જ્વાર મકાઈ કે)
થણા	ચને
વૃદ્ધ	બૂઢે
જુવાન	યુવા
ફરતે	ચારોં ઓર
સારા સારા	અચ્છે-અચ્છે
માલણ	માલિન
આમ	એસા
ધોતી	ધોતી
છૂટી ગયું	ખુલ ગયા
પણાડવું	પટકના
થાકવું	થકના
ફરજ	ફર્જ
અહીં સુધી	યહુંતક
સંતાતો સંતાતો	છિપતે-છિપતે
સીસોટી	સીટી
વગાડતાં	બજાતા
ઢંડો	ઢંડા
ડાબીભાજુ	બાએં
જમણીભાજુ	દાએં
છેલ્લા	અંત મે
હોળાયાં	બડોલિયાં

### અભ્યાસ

#### I નીચે આપેલાં વાક્યોનો અભ્યાસ કરો.

1. 1) હોળી માટે જ્વયા સાફ કરી ઢોલે ઢોલે પાણી છાંટ્યું.  
2) ચકચકતા બુટનો ખટ-ખટ અવાજ થયો.  
3) અમે છોકરાઓ છોકરાઓએ હોળી પ્રગટાવવા માટેની તૈયારી કરી.  
4) માલણ બનેલી મંજુલા બોલી, ફૂલ લો ફૂલ રંગરંગના ફૂલ.  
5) હરિ હરિ બોલતાં મંત્રોચ્ચાર કરતાં કમલેશ આવ્યો.

- 6) છોકરીઓ છોકરીઓ ડાબીબાજુ અને છોકરાઓ છોકરાઓ જમણી બાજુ ઉભા રહો.
2. 1) પછી મોટામોટા છોકરાઓએ બરાબર આઠ વાગે હોળી પ્રગટાવી.  
2) ફેસના કાર્યક્રમમાં ભાગ લેનાર છોકરાઓ સારા સારા પોશાક પહેરી તૈયાર હતા.  
3) નાનાં નાનાં છોકરાંએ ઘેર ઘેર ફરી પૈસા એકઠા કર્યા.
3. 1) બધાંની સામે આવીને માલણ બનેલી મંજુલા ધીરે ધીરે બોલી.  
2) પોલિસથી બચવા હું જલ્દી જલ્દી દોડયો.
4. 1) સ્ત્રી પુરુષોએ પાણી લઈને હોળીની આજુબાજુ ફરતાં ફરતાં પ્રદક્ષિણા કરી.  
2) આમ બોલતી બોલતી પસાર થઈ.  
3) મંત્રોચ્ચાર કરતાં કરતાં ધોતી પહેરી બ્રાહ્મણ બનેલો કમલેશ આવ્યો.  
4) પોલિસ બનેલો તુખાર દોડતો દોડતો આવ્યો.  
5) લાકડી પણાડતો પણાડતો બોલ્યો, હે ભાઈઓ તમે ચોરને જોયો?  
6) ચોર બનેલો નીરજ સંતાતો સંતાતો આવ્યો.  
7) સીસોટી વગાડતાં વગાડતાં પી ટી ટીચર બનેલો કેતન આવ્યો.  
8) નેતાજી ભાષણ આપતાં આપતાં થાકી ગયા.  
9) હું તો તેને શોધતો શોધતો અહીં સુધી આવ્યો.
5. 1) જતાં જતાં ધોતી છૂટી ગઈ અને લોકો હસીને લોથપોથ થઈ ગયા.  
2) તમારે માટે વીણી વીણીને ફૂલો લાવી છું.  
3) ચાલી ચાલીને થાકી ગયો છું.
- II નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાન પર કોષ્ટકમાં આપેલા પ્રત્યેક શબ્દનો ઉપયોગ કરી વાક્યો બનાવો.
1. 1) છોકરાઓએ ઘેરઘેર ફરી પૈસા ભેગા કર્યા.  
(ગલી-ગલી, ગામ-ગામ, શહેર-શહેર)
  - 2) છોકરીઓ છોકરાઓએ હોળી પ્રગટાવવાની તૈયારી કરી.  
(બહેનો-બહેનો, ભાઈઓ-ભાઈઓ, બાળકો-બાળકો)
  - 3) છોકરીઓ-છોકરીઓ ડાબીબાજુ છોકરાઓ-છોકરાઓ જમણી બાજુ.  
(ફૂલ-ફૂલ/ફળ-ફળ, સ્ત્રીઓ-સ્ત્રીઓ/પુરુષો-પુરુષો)

2. 1) મોટા મોટા છોકરાઓએ બરોબર આઠ વાગે હોળી પ્રગટાવી.  
(નાનાનાનાં, સારાંસારાં, ડાખ્યાડાખ્યા)
- 2) ફેસી ડેસના કાર્યક્રમમાં ભાગ લેનાર છોકરાઓ સારાં સારાં કપડાં પહેરી તૈયાર હતા. (નવાનવા, લાલલાલ, ચુંદર-ચુંદર)
3. 1) રજાઓમાં લોકો સાચું જમી જમીને મજા કરે છે.  
(ખાઈખાઈને, પીપીને, જોઈજોઈને)
- 2) તમારે માટે વીણી વીણીને કૂલો લાવી છું.  
(ચૂંટીચૂંટીને, તોડીતોડીને, જોઈજોઈને)
4. 1) પોલિસ બનેલો તુષાર દોડતો દોડતો આવ્યો.  
(ચાલતો ચાલતો, શોધતો શોધતો, ફરતો ફરતો)
- 2) મંજુલા બોલતી બોલતી પસાર થઈ.  
(ગાતીગાતી, કૂદતીકૂદતી, ખાતીખાતી)

### III કોષ્ટકમાં આપેલા શબ્દોમાંથી ઉપયુક્ત શબ્દ પસંદ કરી વાક્યો પૂરાં કરો.

1. (મોટામોટા, ઘેરઘેર, ધીરેધીરે, હરિહરિ, ડોલેડોલે)
- 1) છોકરાઓએ \_\_\_\_\_ ફરીને પૈસા એકઠા કર્યું.
  - 2) \_\_\_\_\_ વદતાં મંત્રોચ્ચાર કરતાં કરતાં કમલેશ આવ્યો.
  - 3) જગ્યા સાફસુફ કરી \_\_\_\_\_ પાણી લાંટયું.
  - 4) મંજુલા બધાની સામે આવીને \_\_\_\_\_ બોલી.
  - 5) \_\_\_\_\_ છોકરાઓએ આઠ વાગે હોળી પ્રગટાવી.
2. (ચાલી ચાલીને, વીણી વીણીને, હસી હસીને)
- 1) લોકો \_\_\_\_\_ લોથપોથ થઈ ગયા.
  - 2) હું તો \_\_\_\_\_ થાકી ગયો છું.
  - 3) તમારે માટે \_\_\_\_\_ કૂલો લાવી છું.
3. (સંતાતો સંતાતો, દોડતો દોડતો, આપતાં આપતાં, મરતાં મરતાં, ગાતીગાતી)
- 1) પોલિસ બનેલો તુષાર \_\_\_\_\_ આવ્યો.
  - 2) માલણ બનેલી મંજુલા \_\_\_\_\_ પસાર થઈ.
  - 3) ચોર બનેલો નીરજ \_\_\_\_\_ આવ્યો.
  - 4) પૂરપાટ જતી મોટરોની અડફેટથી \_\_\_\_\_ બચ્યો.
  - 5) નેતા બનેલો અંજિત ભાષણ \_\_\_\_\_ થાકી ગયા.

**IV ઉદાહરણ અનુસાર કોષ્ટકમાં આપેલા શબ્દોનાં ઘોય રૂપોનો ઉપયોગ કરી વાક્યો પૂરાં કરો.**

ઉદાહરણ: પોલિસ બનેલો તુષાર \_\_\_\_\_ આવ્યો. (દોડ)  
પોલિસ બનેલો તુષાર દોડતો દોડતો આવ્યો.

- 1) હું તો તેને \_\_\_\_\_ આવ્યો. (શોધવું)
- 2) મંજુલા \_\_\_\_\_ પસાર થઈ. (બોલવું)
- 3) ચોર બનેલો નીરજ \_\_\_\_\_ આવ્યો. (સંતાવું)
- 4) પક્ષી ત્યાંથી \_\_\_\_\_ પસાર થયું. (ગાવું)
- 5) સીસોટી \_\_\_\_\_ કેતન આવ્યો. (વગાડવું)

**V ઉદાહરણ અનુસાર આપેલાં વાક્યોનું પરિવર્તન કરો.**

1. ઉદાહરણ: હું ચાલીને આવ્યો છું.  
હું ચાલી ચાલીને આવ્યો છું.

- 1) હું શોધીને આવ્યો છું.
- 2) હું દોડીને આવ્યો છું.
- 3) હું મંત્રોચ્ચાર કરીને આવ્યો છું.
- 4) હું ભાષણ આપીને આવ્યો છું.
- 5) હું વીળીને ફૂલો લાવી છું.

2. ઉદાહરણ: હું ચાલી ચાલીને આવ્યો છું.  
હું ચાલતો ચાલતો આવ્યો છું.

- 1) હું શોધી શોધીને આવ્યો છું.
- 2) હું દોડી દોડીને આવ્યો છું.
- 3) હું ફૂલો વીળી વીળીને આવી છું.
- 4) હું ભાષણ આપી આપીને આવ્યો છું.
- 5) હું મંત્રોચ્ચાર કરી કરીને આવ્યો છું.

**VI કોષ્ટકમાં આપેલા હિન્દી શબ્દોના સમાનાર્થી ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરી વાક્યો પૂરાં કરો.**

- 1) હેસી ડ્રેસ કાર્પ્ટકમમાં ભાગ લેનારા છોકરાઓ \_\_\_\_\_ પોશાક પહેરીને તૈયાર હતા. (અચ્છે-અચ્છે)
- 2) છોકરાઓએ \_\_\_\_\_ ફરીને પૈસા ભેગા કર્યા. (ઘર-ઘર)
- 3) તમારે માટે \_\_\_\_\_ ફૂલો લાવી છું. (ચુન-ચુનકર)
- 4) હું તો ચોરને \_\_\_\_\_ આવ્યો છું. (ઢુંઢતે-ઢુંઢતે)
- 5) મોટરની અડફિટથી \_\_\_\_\_ બચ્યો. (મરતે-મરતે)
- 6) લાકડી \_\_\_\_\_ તુષાર આવ્યો. (પટકતે-પટકતે)
- 7) અજિત ભાષણ \_\_\_\_\_ થાકી ગયો. (દેતે-દેતે)

## વાંચો અને સમજો.

### વ્યક્તિત્વ

વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખાણ તેના વર્તનથી થાય છે. જેનું જેવું વર્તન તેનું તેવું માન. સાચું વર્તન સારી સંગતથી કેળવી શકાય છે. જેની સંગત સારી હશે તેની ચાલચલગત પણ સારી હશે. જેમ સારાસારા મિત્રો પાસેથી સાચું સાચું શીખવા મળે છે. તેમ ઘણા છોકરાઓને સીગરેટ પીવાની કુટેવ હોય છે. તેમાંથી કેટલાકને જમતાં જમતાં વાત-ચીત કરવાની ટેવ હોય છે. જેથી સામેવાળા વ્યક્તિ ઉપર તેની ખરાબ છાપ પડે છે. ઘણાંને ટી.વી. જોતાં જોતાં જમવાની ટેવ હોય છે. જે તેમના સ્વાસ્થ માટે નુકસાનકારક છે. સુટેવ ધીરે ધીરે કેળવી શકાય છે અને કુટેવ ધીરે ધીરે છોડી પણ શકાય છે. આવી તો ઘણી સુટેવો-કુટેવો આપણા બધામાં જોવા મળે છે.

કુટેવ આપણું ધન અને માન બંને ઘટાડે છે. કુટેવને એકાએક છોડવી અધરી છે પણ પ્રયત્ન કરતાં કરતાં તેને ધીરે ધીરે છોડી પણ શકાય છે. સારી સારી ટેવોથી વ્યક્તિની ચાલચલગતમાં પણ ફરક પડે છે. અને સારી ટેવોથી સમાજમાં તેનું માન પણ વધે છે. તેથી જ કહ્યું છે કે, જો ધન ગયું તો કંઈ નહીં પણ જો માન ગયું તો બધું જ ચાલ્યું ગયું.

### શબ્દાથ

ગુજરાતી શબ્દ	હિંદી અર્થ
વ્યક્તિત્વ	વ્યક્તિત્વ
વર્તન	બર્તાવ
કેળવવું	ગ્રહણ કરના/વિકાસ કરના/સુધારના
ચાલચલગત	ચાલ ચલન
ટેવ	આઉત
સુટેવ	અચ્છી આદત
કુટેવ	બુરી આદત
છોડવું	છોડના
સામેવાળા	સામનેવાળા
છાપ	પ્રભાવ
સ્વાસ્થ	સ્વાસ્થ્ય
નુકસાનકારક	હાનીકારક
ઘટણું	કમહોના
એકાએક	એકાએક/અચાનક

### અત્યાસ

**I નીચે આપેલા પ્રશ્નોના જવાબ ફકરાના આધારે આપો.**

- 1) વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખાણ કેવી રીતે થાય છે?
- 2) ખરાબ મિત્રો પાસેથી શું શીખવા મળે છે?
- 3) જમતાં જમતાં કેવી ટેવો હોય છે?
- 4) સુટેવ કેવી રીતે કેળવાય અને કુટેવ કેવી રીતે છોડાય?
- 5) વ્યક્તિની ચાલચલગતમાં કેવી રીતે ફરક પડે છે?

**II નીચે આપેલા હિન્દી શબ્દો માટે ગુજરાતી શબ્દો આપો.**

અચ્છી, આદત, બુરી આદત, ગ્રહણ કરના, પ્રભાવ, હાનીકારક, બર્તાવ, સામનેવાલા, કમહોના

**III નીચે આપેલા શબ્દોને ફકરાને આધારે ઘોગ્ય રીતે જોડો.**

- |                |           |
|----------------|-----------|
| 1. સારી સારી   | - જમતાં   |
| 2. ધીરે ધીરે   | - છોડવું  |
| 3. એકાએક       | - સુટેવ   |
| 4. કરતાં કરતાં | - ચાલવું  |
| 5. વાતચીત      | - પ્રયત્ન |

**IV હિન્દીમાં અનુવાદ કરો.**

સંસારમાં ત્રણ અતિપૂજ્ય છે. માતા, ગુરુ અને ઈશ્વર. તો પણ આપણે કહી શકીએ છીએ કે જો ગુરુ અને ઈશ્વર પૂજ્ય છે તો મા અતિપૂજ્ય છે. કોઈપણ ઘરમાં બાળકના જન્મથી આનંદ આનંદ થઈ જાય છે. તેમાંથી માના હરખનો તો પાર રહેતો નથી. જ્યારે બાળક જન્મ લેતાં જ ઉઅાં... ઉઅાં....કરી રડવા લાગે છે ત્યારે આખું ઘર આનંદથી ભરાઈ જાય છે. મા પણ બાળક માટે અનેક તૈયારીઓ કરે છે. જાતજાતનાં કપડાં, જુદાંજુદાં રમકડાં, ઘોડિયું વગેરે લાવે છે. રંગબેરંગી ઊનથી સ્વેટર, મોજા જેવાં ગરમ વસ્ત્રો બનાવે છે. સૌથી વધારે ધ્યાન તે બાળકનું રાખે છે. તેની ટગરટગર જોતી આંખો, નાના નાના પગ, કુણાકુણા હાથ, કોમળ કોમળ શરીર બધાને આકર્ષિત કરે છે. પડોસીઓનાં બાળકો તે શિશુને વારંવાર રમાડવા આવે છે. ધીરે ધીરે તે મોટું થાય છે. અને નવીનવી દુનિયાને ઓળખવા લાગે છે. જેમજેમ બાળક મોટું થાય છે તેમતેમ માતાનો હરખ પણ વધતો જાય છે. માતા શિશુની મીઠી-મીઠી વાળી સાંભળી મનમાં અને મનમાં મલકાય છે. તેની કાલીકાલી બોલી સાંભળવા માટે ઘરના સભ્યો તેને બોલવા માટે પ્રેરે છે. બાળક પણ મા....મા..., કા...કા..., બા...બા..., દા....દા..... જેવા સંભોધનોથી બધાંને આકર્ષે છે. આમ, શિશુ જન્મતાની સાથે જ બધાનું ધ્યાન ખેચે છે. મા માટે તો તેનું બાળક સંસારની બધી જ સંપત્તિઓમાં અમૂલ્ય છે. મા પોતાની બધી જ ખુશીઓને નેવે મૂકીને બાળકની દરેક ખુશીનું ધ્યાન રાખે છે. તેથી જ મા અતિપૂજ્ય છે.

### શબ્દાચ

ગુજરાતી શબ્દ	હિંદી અર્થ
અતિપૂજ્ય	अतिपूज्य
તેમાંધ	उસ મેં ભી
હરખ	હર્ષ
પાર	સીમા
ભરાઈ જાય	ભર જાતા
ઘોડિયું	પાલના (બચ્ચે કો ઝુલાને કા ઝુલા)
ળીન	ऊન
વસ્ત્રો	વस્ત્ર (બહુવચન)
૨૦૨૨૦૨	ટક-ટકી લગાકર
કુણાકુણા	નરમ-નરમ
કોમળ કોમળ	કોમલ-કોમલ
રમાડવું	ખેલાના
ઓળખવું	પહ્યાનના
મલકાવવું	મુસ્કરાના
કાલીકાલી	તોતલી-તોતલી
પ્રેરવું	પ્રેરિત કરના
સંબોધન	સંબોધન
સભ્યો	સદસ્ય/શિષ્ટ
સંપત્તિ	સંપત્તિ
અમૂલ્ય	અમૂલ્ય/મૂલ્યવાન
નેવે મૂકીને	ભૂલકર

### V ગુજરાતીમાં અનુવાદ કરો.

ભારત ગાঁંધો કા દેશ હૈ। કૃષિ હમારે ગાঁંધો કા મુખ્ય વ્યવસાય હૈ। હમારે દેશ કા આર્થિક આધાર કૃષિ હી હૈ। કિસાન કે લિએ તો કૃષિ હી ધન હૈ। ફસલ પકતે હી કિસાન કે પાસ પેસા આતા હૈ। કૃષિ કા કામ બહુત શ્રમ કા કામ હૈ।

કિસાન હલ સે જોત-જોતકર ખેતોં કો બોને યોગ્ય બનાતા હૈ। ફિર વહ વર્ષા હોને પર બીજ બોતા હૈ। કેવળ બીજ બોને સે હી ફસલ નહીં પક જાતી। ઇસકે બાદ ભી ઉસે બહુત શ્રમ કરના પડતા હૈ। ફસલ કો પકતે-પકતે તીન ચાર મહીને લગ જાતે હૈને। ફસલ પક જાને પર ઉસે કાટ-કાટ કર વહ ખલિહાન મેં લાતા હૈ। ખલિહાન મેં ઉસે ગહા-ગહા કર ઉસમે સે અનાજ નિકાલતા હૈ। ઉસકે બાદ અપને અનાજ કો ગાડિયોં મેં ભર-ભર કર અપને ઘર લેજાતા હૈ। ફિર વહ બાજાર જાકર મોલ ભાવ કરતા હૈ। અચ્છા ભાવ હોને પર વહ અપના અનાજ બેચતા હૈ।

ફસલ કા પૈસા પ્રાપ્ત હોજાને કે બાદ વહ અપની આવશ્યકતા કી વસ્તુએ ખરીદતા હૈ। આવશ્યક વસ્તુએ ખરીદને કા અવસર ઉસે હાટ મેં યા મેલોં મેં હી મિલતા હૈ। મેલે કિસી વિશેષ અવસર પર ધ્યાન રખકર હી આયોજિત હોતે હૈનું। બહુધા મેલોં કા આયોજન ધાર્મિક સ્થળોં પર ઔર ધાર્મિક ત્યોહરોં પર હોતા હૈ।

મેલોં મેં દૂકાનદાર દૂર-દૂર સે અપની-અપની દૂકાને લેકર આતે હૈનું। મેલા એક પ્રકાર કા અસ્થાઈ બાજાર હોતા હૈ। મેલોં મેં મનોરંજન કે ભી કર્ડ સાધન હોતે હૈનું। મેલે મેં કેવળ સામાન ખરીદને વાલે હી નહીં જાતે। બુઢે-બચ્ચે લડકે લડકિયાં, યુવક યુવતિયાં સભી મેલે મેં જાતે હૈનું। બચ્ચે તો વર્ષ ભર પ્રતિ દિન અપની ગુલ્લક મેં પૈસે બચા-બચા કર મેલે મેં જાને કી તૈયારી કરતે હૈનું। ઉન્હેં ઝૂલોં મેં ઝૂલને કા બઢા શૌક હોતા હૈ। ઝૂલોં મેં ઝૂલતે-ઝૂલતે વે આનંદિત હોતે હૈનું। મેલોં મેં ધકકા-મુકકી ભી ખૂબ હોતી હૈ। ખૂબ ભીડું-ભાડું હોતી હૈ। ઇસી કો તો મેલા કહતે હૈનું। મેલે કા જિતના ધાર્મિક મહત્વ હૈ ઉતના હી સાંસ્કૃતિક ઔર આર્થિક મહત્વ ભી હૈ।

### શબ્દાર્થ

હિંદી શબ્દ	ગુજરાતી અર્થ
વ્યવસાય	વ્યવસાય
કિસાન	ખેડૂત
કૃષિ	ખેતી
ફસલ	પાક
હલ	હળ
જોતના	ખેડવું
બોના	વાવવું
બીજ	બી/બીજ/બિયારણ
કાટના	લણવું
ખલિહાન	ખળું
ગહાના	હાલદું કરવું (પાકમાંથી દાણા છૂટા પાડવા માટે ખળામાં બળદ ફેરવે તે કિયા)
બેચના	વેચવું
હાટ	હાટડીઓ અને લારીઓનું નાનું અસ્થાયી બજાર.
મેલા	મેળો
ગુલ્લક	પૈસા ભેગા કરવાનો ગલ્લો
ધકકા મુકકા	ઘક્કામૂક્કી
ભીડુંભાડું	ભીડ

VI તમે જોયેલા કોઈ સરધસ વિશે શબ્દોની દ્વિકુંભિત/પુનર્કુંભિતનો ઉપયોગ કરી ગુજરાતીમાં એક અનુચ્છેદ લખો.  
જેમકે.. કરતાં કરતાં, દોડતાં દોડતાં, જોતાં જોતાં વગરે.

### ટિપ્પણિયાં

I ઇસ પાઠ મें ગુજરાતી કे વિવિધ શબ્દોं કे પુનરુક્ત પ્રયોગોं કा પરિચય દિયા ગયા હૈ।

1. 1) ફૂલ લો ફૂલ રંગરંગના ફૂલ. ફૂલ લો, રંગ-રંગ કે ફૂલ।  
2) હોળી માટે જગા સાફ કરી ડોલે ડોલે પાણી છાંટયું. હોળી કે લિએ જગહ કર કે બાલ્ટી-બાલ્ટી સે (બાલ્ટિઓં સે) પાની છિંડકા।  
3) છોકરીઓ છોકરીઓ ડાખીબાજુ અને છોકરાઓ છોકરાઓ જમણી બાજુ ઊભા રહો. લડકિયાં-લડકિયાં બાઈ તરફ ઔર લડકે-લડકે દાઈ તરફ ખંડે રહો।

ઉપર કે વાક્યોમાં રેખાંકિત સંજ્ઞા શબ્દોની પુનરુક્તિ હુઈ હૈ। વાક્ય (1) માં 'રંગ-રંગ' (રંગ-રંગ) પ્રયોગ રંગોની ભિન્નતા કા બોધ કરાતા હૈ। વાક્ય (2) માં 'ડોલે-ડોલે' પ્રયોગ પાનીની એક કે બાદ એક બાલ્ટી સે પાની કે છિંડકને કી રીતિ બતાતા હૈ। વાક્ય (3) માં 'છોકરીઓ છોકરીઓ' (છોકરીઓ-છોકરીઓ) ઔર 'છોકરાઓ છોકરાઓ' (છોકરાઓ-છોકરાઓ) કે વર્ગ યા સમૂહ કા બોધ કરાતે હોય।

II

1. 1) પણી મોટામોટા છોકરાઓએ બરાબર આઠ વાગે હોળી પ્રગટાવી. બઢે-બઢે લડકોને ઠીક શામ આઠ બજે કો હોળી પ્રજ્વલિત કી।  
2) ફેસી ડેસના કાર્યક્રમમાં ભાગ લેનાર છોકરાઓ સારા સારા પોષાક પહેરી તૈયાર હતા. લલિત વેષ માં ભાગ લેનેવાલે બચ્ચે અચ્છી-અચ્છી પોશાક કે પહન કર તૈયાર થે।

ઉપર્યુક્ત વાક્યોમાં રેખાંકિત વિશેષણ-શબ્દોની પુનરુક્તિ હુઈ હૈ। ઇસ પ્રકાર કી પુરનરુક્તિ બલબોધકતા (અવધારણ) કા બોધ કરાતી હૈ।

2. 1) બધાંની સામે આવીને માલણ બનેલી મંજુલા ધીરે ધીરે બોલી. સબ કે સામને આકર માલિન બની હુઈ મંજુલા ધીરે-ધીરે બોલી।

- 2) पोलिसथी बचवा हुं જલ્દી જલ્દી पुलीस से बचने में जल्दी-जल्दी दौड़ा।  
दोડ्यो।

उक्त वाक्यों में रेखांकित क्रिया-विशेषण की पुनरुक्ति का प्रयोग हुआ है। इस प्रकार की पुनरुक्ति भी हिंदी पुनरुक्ति के समान है।

- III 1) पोलिस बनेलो तुખार દોડતो पुलीस बना हुआ तुषार दौड़ता-दौड़ता  
दોડतो आय्यो। आया।  
2) चोर बनेलो नीरજ संतातो चोर बना हुआ नीरज छिपते-छिपते आया।  
संतातो आय्यो।

उक्त वाक्यों में वर्तमान कालिक कृदंत की पुनरुक्ति हुई है। यह पुनरुक्ति क्रिया विशेषण है। यह पुनरुक्ति असमापिका क्रिया की निरंतरता का बोध कराती है। क्रिया के साथ लिंग और वचन के अनुसार 'तो' (तो), 'ती' (ती), 'तुं' (तु) जोड़े जाते हैं।

जैसे:

- |    |  |   |
|----|--|---|
| 1) | कूल लो <u>રंગરंगनां</u> बोलती<br>बोलती मंजुला आवी।     | फूल लो, रंग-रंग के, बोलती-बोलती<br>मंजुला आई। |
| 2) | पोलिस बनेलो तुખार <u>दોડतो</u><br><u>दોડतो</u> आय्यो।  | पुलीस बना हुआ तुषार दौड़ता-दौड़ता<br>आया।     |
| 3) | ऐटलामां पक्षी त्यांथी <u>ગातुं ગातुं</u><br>पसार थयुं. | इतने में पक्षी वहाँ से गाते-गाते गुजारा।      |
- 
- |       |                                  |                          |
|-------|----------------------------------|--------------------------|
| IV 1) | હसी <u>હसीने</u> पेट दુःखी गयुं. | हँस-हँस कर पेट दुःख गया। |
| 2)    | <u>चाली</u> चालीने थाकी गयो धुं. | चल-चल कर थक गया हूँ।     |

उक्त वाक्यों में 'पूर्वकालिक कृदंत की पुनरुक्ति हुई है। इस में पुनरुक्ति के दूसरे कृदंत के साथ 'ने' (ने) परसर्ग जोड़ा गया है। यह पुनरुक्ति क्रिया की कारणवाचक रीति का बोध कराती है। ध्यान दीजिए कि हिंदी में भी ऐसी पुनरुक्तियों का प्रयोग होता है।